

વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ

-:: તાલીમ કાર્યક્રમ ::-

તાલીમાર્થીઓ	: સેન્ટર ઓફ કોમ્યુનિકેશન નેટવર્ક યોજના અને એગ્રીકલ્ચર ડેમોસ્ટ્રેશન એક્ટીવીટીઝ ઈન એનએસપી કમાન્ડ એરિયા ફેઝ-૨ અંતર્ગત
તાલીમાર્થીઓનો વિસ્તાર	: સુરેન્દ્રનગર જિલ્લાના તાલીમાર્થી બહેનો
તાલીમનો સમયગાળો	: તા.૦૩/૦૯/૨૦૨૫ થી તા.૦૫/૦૯/૨૦૨૫
તાલીમાર્થીઓની અંદાજિત સંખ્યા	: ૪૫ (પિરતાલીસ)
તાલીમનું સ્થળ	: કિસાન વિકાસ ભવન, સરદાર સ્મૃતિ કેન્દ્ર, જૂ.કૃ.યુ., જૂનાગઢ

-:: તાલીમ સંકલનકાર ::-


ડૉ. ટી. ડી. કપુરીયા
ડૉ. એમ. વી. પોકાર
શ્રી સી. કે. ધરજીયા

-:: તાલીમ કાર્યક્રમ ::-

તારીખ/સમય	વિષય	વડતા
તા. ૦૩/૦૯/૨૦૨૫		
૦૮.૦૦ થી ૦૯.૦૦	આગમન અને નોંધણી, તાલીમાર્થીઓનો પરિચય, તાલીમનું મહત્વ, તાલીમાર્થીઓની વિષય રૂચિ અંગે ચર્ચા.	ડૉ. ટી. ડી. કપુરીયા અને શ્રી સી. કે. ધરજીયા જૂ.કૃ.યુ. જૂનાગઢ
૦૯.૦૦ થી ૦૯.૩૦	તાલીમ વર્ગનું ઉદ્ઘાટન	ડૉ. એ. જી. પાનસુરીયા ડૉ. એન. બી. ખડવા જૂ.કૃ.યુ. જૂનાગઢ
૦૯.૩૦ થી ૧૧.૦૦	બાયો-કંટ્રોલ લેબ, તેલીબિયા કહોળ કપાસ અને શાકભાજી સંશોધન કેન્દ્રની મુલાકાત અને ચર્ચા	ડૉ. એસ. એમ. ભાભોર ડૉ. સક્ષી માવાણી જૂ.કૃ.યુ. જૂનાગઢ
૧૧.૦૦ થી ૧૨.૩૦	કપાસ પાકમાં ખાતરોની જરૂરિયાત અંગે માહિતી	પ્રાધ્યાપક અને વડાશ્રી, કૃષિ રસાયણશાસ્ત્ર વિભાગ, કૃષિમહાવિદ્યાલય, જૂ.કૃ.યુ., જૂનાગઢ
૧૨.૩૦ થી ૧૪.૪૫	ભોજન વિરામ	
૧૪.૪૫ થી ૧૫.૪૫	કપાસની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ	સંશોધન વૈજ્ઞાનિકશ્રી, કપાસ સંશોધન કેન્દ્ર જૂ.કૃ.યુ. જૂનાગઢ
૧૫.૪૫ થી ૧૬.૪૫	કપાસ પાક ઉત્પાદનમાં બીજનું મહત્વ અને અગત્યની ખતો અંગે ચર્ચા	સંશોધન વૈજ્ઞાનિકશ્રી, કપાસ સંશોધન કેન્દ્ર જૂ.કૃ.યુ. જૂનાગઢ
૧૬.૪૫ થી ૧૭.૦૦	સા વિરામ	
૧૭.૦૦ થી ૧૮.૦૦	કૃષિ મશીનરીમાં ખેડૂત બહેનો માટે અનુકૂળ ટેકનોલોજીની માહિતી અને મુલાકાત	પ્રાધ્યાપક અને વડાશ્રી, ક્ષાર્મ અને પાવર ઇજનેરી વિભાગ, કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય, જૂ.કૃ.યુ. જૂનાગઢ
તા. ૦૪/૦૯/૨૦૨૫		
૦૯.૦૦ થી ૧૦.૩૦	ખરીફ (મગફળી/કપાસ) પાકોના જીવાત અને તેનું નિયંત્રણ	પ્રાધ્યાપક અને વડાશ્રી, કિટકશાસ્ત્ર વિભાગ, જૂ.કૃ.યુ. જૂનાગઢ

૧૦.૩૦ થી ૧૦.૪૫	સા વિરામ	
૧૦.૪૫ થી ૧૨.૧૫	ખરીફ (મગફળી/કપાસ) પાકોના રોગ અને તેનું નિયંત્રણ	પ્રાધ્યાપક અને વડાશ્રી, વનરૂપિત રોગશાસ્ત્ર વિભાગ, જૂ.ફ.યુ. જૂનાગઢ
૧૨.૧૫ થી ૧૫.૦૦	ભોજન વિરામ	
૧૫.૦૦ થી ૧૮.૦૦	જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની બેકરીની મુલાકાત	ડૉ. ડી. એસ. ઠાકર મદદનીશ પ્રાધ્યાપક, જૂ.ફ.યુ. જૂનાગઢ
તા. ૦૫/૦૮/૨૦૨૫		
૦૮.૦૦ થી ૧૦.૩૦	મગફળી/કપાસના પાક માટે સિંચાઈની પદ્ધતિઓ અને જળસંગ્રહ ક્ષમતા વધારવાની પદ્ધતિઓ	પ્રો. વી. કે. ડોબરીયા મદદનીશ પ્રાધ્યાપક, જૂ.ફ.યુ. જૂનાગઢ
૧૦.૩૦ થી ૧૦.૪૫	સા વિરામ	
૧૦.૪૫ થી ૧૨.૧૫	જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતી જુદી જુદી પ્રવૃત્તિઓની માહિતી	ડૉ. ટી. ડી. કપુરીયા મદદનીશ પ્રાધ્યાપક, જૂ.ફ.યુ. જૂનાગઢ
૧૨.૦૦ થી ૧૫.૦૦	ભોજન વિરામ	
૧૫.૦૦ થી ૧૭.૦૦	કૃષિ દર્શનાલય, એગ્રીરનેટ સ્ટુડીઓ અને એસ.એસ.કે.ની મુલાકાત	ડૉ. એચ. સી. છોડવાડીયા ડૉ. જે. વી. ચોવટીયા જૂ.ફ.યુ. જૂનાગઢ
૧૭.૩૦ થી ૧૭.૦૦	આભાર વિધિ અને પ્રતિભાવ તથા સમાપન	શ્રી સી. કે. ઘરલયા કપાસ સંશોધન કેન્દ્ર, કુડડા, જૂ.ફ.યુ. જૂનાગઢ

ઉપરોક્ત કાર્યક્રમમાં બેઠૂતોને કૃષિ વિષયક આધુનિક માહિતી મળી રહે તે માટે આપશ્રી/આપશ્રીના પ્રતિનિધિને તજજ્ઞ તરીકે ઉપરિચિત રહેવા આથી જણાવવામાં આવે છે


વિસ્તરણ શિક્ષણ નિયામક

ખ.નં. જૂફયુ/વિશિનિ/ટેક-ક/તાલીમ/સીઓસી/ ૫૪૬૩-૫૫૫૫/૨૫ જૂનાગઢ, તા : ૨૬/૦૮/૨૦૨૫

નકલ સવિનય રવાના :

- (૧) માન. કુલપતિશ્રીના રહસ્ય સચિવશ્રી, જૂ.ફ.યુ. જૂનાગઢ તરફ જણ થવા સારું.
- (૨) સંશોધન નિયામકશ્રી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ તરફ જણ થવા સારું.

નકલ જયભારત રવાના :

- (૧) નિયામકશ્રી, આઈ.ટી. સેલ, જૂ.ફ.યુ. જૂનાગઢ વેબસાઈટ પર ન્યુઝ રૂપે મુકવા સારું.
- (૨) આચાર્ય અને ડીનશ્રી, કૃષિ મહાવિદ્યાલય, જૂ.ફ.યુ. જૂનાગઢ તરફ જણ થવા સારું.
- (૩) આચાર્ય અને ડીનશ્રી, કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય, જૂ.ફ.યુ. જૂનાગઢ તરફ જણ થવા સારું.
- (૪) સંશોધન વૈજ્ઞાનિકશ્રી, કપાસ સંશોધન કેન્દ્ર, જૂ.ફ.યુ. જૂનાગઢ તરફ જણ થવા સારું.
- (૫) પ્રાધ્યાપક અને વડાશ્રી, કીટકશાસ્ત્ર વિભાગ, જૂ.ફ.યુ. જૂનાગઢ તરફ જણ થવા સારું.
- (૬) પ્રાધ્યાપક અને વડાશ્રી, રોગશાસ્ત્ર વિભાગ, જૂ.ફ.યુ. જૂનાગઢ તરફ જણ થવા સારું.
- (૭) પ્રાધ્યાપક અને વડાશ્રી, કૃષિ રસાયણશાસ્ત્ર વિભાગ, જૂ.ફ.યુ. જૂનાગઢ તરફ જણ થવા સારું.
- (૮) પ્રાધ્યાપક અને વડાશ્રી, ક્ષાર્મ અને પાવર ઇજનેરી વિભાગ, જૂ.ફ.યુ. જૂનાગઢ તરફ જણ થવા સારું.

નકલ રવાના :

- (૧) સર્વે સંબંધિત વૈજ્ઞાનિકશ્રીઓ/વક્તાઓ તરફ જણ તથા આપના વ્યાખ્યાનમાં સમયસર હાજર રહેવા સારું.
- (૨) મદદનીશ વિસ્તરણ શિક્ષણશાસ્ત્રી, સરદાર સ્મૃતિ કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ તરફ જણ તેમજ કિસાન વિકાસ ભવન અને તાલીમાર્થીઓ માટે રહેવાની વ્યવસ્થા કૃષિકાર અતિથિ ભવનમાં કરવા ઘટતુ થવા સારું.